

CIN NO: L17299GJ1993PLC032905 AN IS/ISO: 9001: 2015 COMPANY

Date: 29th July, 2023

To,

The Secretary,

Corporate Relationship Department, Bombay Stock Exchange, 1st Floor, New Trading Ring, Rotunda Building, P.J. Towers, Dalal Street, Mumbai - 400 001

Sub: Compliance under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir,

pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith newspaper copies of Notice calling Board Meeting published in the following newspapers on 29th July, 2023:

- The Newsline (Gujarati)
- Chanakya Ni Pothi (English)

This is for your kind information and record please.

Yours faithfully, For Polylink Polymers (India) Limited

Ankit Vageriya Company Secretary

Head Office:

506, Saffron Building, Near Center Point, Ambawadi, Ahmedabad - 380 006. Phone: 079-26427800, 26565200 Tele Fax: 91-79-26421864

E-mail: polylink@polylinkpolymers.com Website: www.polylinkpolymers.com

Registered Office (Works): Block No. 229-230, Vill - Valthera, Dholka-Bagodara Highway, Taluka-Dholka, Dist.-Ahmedabad-382225

એનાલિસ્ટો અત્યારના શેરબજારના ઘટાડા માટે કંપનીઓના પરિણામો નબળા આવવાનું કારણ દર્શાવે છે

અંક : ૨૮૧



નિફ્ટી ખૂબ જ ઝડપથી વધીને ૨૦૦૦૦ નજીક પહોંચી ગઈ હોવાથી સ્વાભાવિક છે તેને થાક લાગે અને તેને કારણે છેલ્લી થોડીક સેશનોથી ભારતીય બજારમાં કરેકશનનો ટ્રેન્ડ જોવાય છે અને આ કરેકશન માટે ભલે અલગ અલગ એનાલિસ્ટો અને ખેલાડીઓ અલગ અલગ કારણ આપતા હોય પરંતુ વાસ્તવિક કારણ ખૂબ જ ઝડપી ઉછાળા પછીનું આ એક નોર્મલ કરેકશન અને પ્રોફિટ બુકિંગ છે.

અમેરિકન બજારમાં ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષા મુજબ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો વધારો કરાયો અને તે પછી ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવા અંગે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેને કારણે બજારમાં થોડીક નર્વસનેસ ઊભી થઈ છે. હવે શુક્રવારે સવારે એટલે કે ભારતીય બજાર બંધ થયા પછી અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થશે અને આ આંકડા કેવા આવે છે તેની ઉપર વિશ્વભરના ખેલાડીઓની નજર ગયા અઠવાડિયા દરમ્યાન રહી હતી અને તેને કારણે ગુરુવારે અમેરિકન શેરબજારમાં ફ્લેટ અને નિરસ ટ્રેન્ડ જોવાયો.

કંપનીઓના અમેરિકન આંકડાઓમાં મિશ્ર ટ્રેન્ડ જોઈ શકાય છે. ઇન્ટેલના પરિશામોમાં ખૂબ સુંદર ઉછાળો આવ્યા પછી શેરના ભાવમાં એક જ સેશનમાં સાત ટકાનો ઉછાળો જોવાયો હતો. જયારે અન્ય આઈટી કંપનીઓના પરિણામોમાં થોડીક નબળાઈ જોવાઈ છે.

અમેરિકન ઇન્વેસ્ટરો અત્યારે જૂન મહિનાના વ્યક્તિગત ખર્ચના આંકડાઓ અને વ્યક્તિગત ખર્ચ ઇન્ડેક્ષનો અભ્યાસ કરી રહ્યા છે અને આ ઇન્ડેક્ષ ફેડરલ રિઝર્વ ખુબ જ આતૂરતાપૂર્વક અભ્યાસ કરે છે અને તેથી જો આ પ્રાઈસ ઇન્ડેક્ષમાં આગલા મહિનાની સરખામણીમાં ૦.૨ ટકાનો વધારો આવે તો તેને કારણે ફેડરલ રિઝર્વનું વલણ થોડુંક કૂણું પડી શકશે. પરંતુ આગલા વર્ષની સરખામણીમાં પર્સનલ કન્ઝમ્પશન ઇન્ડેક્ષમાં લગભગ ૪.૨ ટકાનો વધારો જોઈ શકાશે.

સામે પક્ષે યૂરોપિયન અર્થતંત્રમાં પણ ફેડરલ રિઝર્વની જેમ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. યૂરોપિયન સેન્ટ્રલ બેંકે પણ ફેડરલ રિઝર્વને અનુસરીને વ્યાજદર હવે સપ્ટેમ્બરમાં વધારવાનું નક્કી કર્યું છે. પરંતુ યૂરોપિયન સેન્ટ્રલ બેંકની આ જાહેરાત પછી પાન યૂરોપ સ્ટોક્સ : ૬૦૦માં ૧.૪ ટકાનો ઉછાળો જોવાયો હતો. યૂરોપિયન સેન્ટ્રલ બેંક હવે ૨૫ બેઝિક પોઈન્ટનો વધારો કરીને તેના મુખ્ય વ્યાજદરને ૩.૭૫ ટકા સુધી લઈ જાય તેવી ગણતરી છે. યૂરોપિયન અર્થતંત્રમાં ફ્રગાવો અંકુશ હેઠળ છે અને ઘટી પણ રહ્યો છે. તેમ છતાં હજી ઘણા લાંબા સમય સુધી કુગાવો ઊંચો રહેશે તે ભય હોવાને કારણે યૂરોપિયન સેન્ટ્રલ બેંક વ્યાજદર વધારવા માંગે છે.

સામે પક્ષે ભારતમાં અત્યારે આર્થિક રીતે કોઈ જ ડેવલપમેન્ટ નથી. આખો દેશ અત્યારે મણિપુરમાં હિંસાઓ અંગે સરકાર અને વિરોધપક્ષના સ્ટેટમેન્ટનો વાંચવામાં મગ્ન છે. બાકી ગયા અઠવાડિયા દરમ્યાન મોટા ભાગના

આવકવેરાના રિટર્ન વેપારીઓ ભરવામાં મશગૂલ હતા અને સામે પક્ષે સરકાર કે નાણામંત્રાલય દ્વારા કોઈ જ

મહત્ત્વની જાહેરાતો નથી કરાઈ.

કંપનીઓના પરિણામો અંગે અત્યારે મિશ્ર મંતવ્યો છે અને કેટલાક એનાલિસ્ટો અત્યારના શેરબજારના ઘટાડા માટે કંપનીઓના પરિણામો નબળા આવવાનું કારણ દર્શાવે છે, પરંતુ આ તો છેલ્લા અઠવાડિયા દરમ્યાન બજાર ઘટ્યું એટલે તેને માટે કારણ આપવું પડે અને તેથી આ એનાલિસ્ટો આ કારણ શોધી લાવ્યા છે. બાકી આગલા અઠવાડિયા દરમ્યાન જયારે ઇન્ડેક્ષ ૨૦૦૦૦ તરફ ધસી રહ્યો હતો ત્યારે તેમને બધા જ પરિણામો સારા લાગતા હતા. માટે આ પ્રકારના એનાલિસીસ ઉપર વિશ્વાસ કરવો નહિ. ગયા ક્વાર્ટરના અત્યાર સુધીના શકાય.

જે પરિણામો આવ્યા છે તેમાં ૨૭૧ લિસ્ટેડ કંપનીઓમાં વ્યાજખર્ચમાં સરેરાશ ૩૬.૨૦ ટકાનો ઉછાળો જોવાયો છે. એપ્રિલથી જુન ક્વાર્ટર દરમ્યાન બેંકોએ વ્યાજદર વધાર્યા હજી આવતા થોડા દિવસો આ શેર મજબૂત છે. હોવાની સીધી અસર કંપનીઓના વ્યાજ ખર્ચ ઉપર પડી છે. સામે પક્ષે મેન્યુફેક્ચરિંગ કંપનીઓના કાચામાલ ખર્ચ અને એનર્જી ખર્ચામાં પ્રથમ ક્વાર્ટર દરમ્યાન ઘટાડો જોવાયો છે. પ્રથમ ક્વાર્ટર દરમ્યાન ક્રૂડના ભાવ નીચા હોવાની સીધી અસર કાચામાલ અને એનર્જી ખર્ચા ઉપર પડી છે. જયારે કંપનીઓના વેચાણોમાં સરેરાશ ૫.૯ ટકાનો વધારો પ્રથમ ક્વાર્ટર દરમ્યાન

ગયા અઠવાડિયા દરમ્યાન બજારનું ફોકસ મુખ્યત્વે જીઓ ફિનાન્સીયલના ડેવલપમેન્ટ ઉપર હતું. એક તરફ જીઓ ફિનાન્સીયલે મ્યુચ્યુઅલ ફંડના ધંધામાં દાખલ થવા માટે બ્લેકરોક સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે અને બીજી તરફ કતાર ઇન્વેસ્ટમેન્ટ ફંડ રિલાયન્સ રીટેઈલમાં એક ટકો હોલ્ડિંગ લેવા માટે જંગી રોકાણ કરી રહ્યું છે અને રિલાયન્સ અંગે આ બે પોઝિટિવ સમાચારો હોવા છતાં શેરના ભાવમાં નબળાઈનો ટ્રેન્ડ જોવાય છે (ચાણક્યની વેબસાઈટ ઉપર રોજેરોજ રિલાયન્સ, ટીસીએસ, ઝોમેટો અને પેટીએમના શેરમાં શું થઈ શકશે તે અંગેનો અંદાજ અપાય છે તે ખાસ

અન્ય એક ડેવલપમેન્ટમાં બ્લેકસ્ટોન અને બારિંગ ગ્રૂપ સિપ્લામાં ૨૦ ટકા હોલ્ડિંગ હસ્તગત કરવાની હરિફાઈમાં છે. સિપ્લાના પ્રમોટરો હમીદ કુટુંબ દ્વારા કંપનીમાં ૨૦ ટકા હોલ્ડિંગ વેચવા માટે તૈયારીઓ શરૂ કરી છે. હમીદ કુટુંબ પાસે અત્યારે ૩૩.૪૭ ટકા હોલ્ડિંગ છે અને જો પોતાના ૨૦ ટકા શેરો તેઓ આપી તે તો તેમની પાસે કેવળ ૧૩.૪૭ ટકા શેરો જ બચશે. અને આ અંગેની મહત્ત્વની જાહેરાત નવા અઠવાડિયામાં આવી જાય તે સંભાવના મજબૂત છે. આઈપીઓ અને ખાસ કરીને એસએમઈ આઈપીઓ એક પછી એક આવતા જ જાય છે અને ફન્ડામેન્ટલમાં કોઈ કસ ન હોય તેવા આઈપીઓ પણ અત્યારે સરળતાથી એક ગણા ભરાઈ જતા હોય એટલે સ્વાભાવિક છે કે પ્રમોટરોને ઝડપથી

રૂા. ૪૫૦ ઉપરના **ઇમામી**ના શેરમાં પણ આવતા થોડા દિવસોમાં સંદર ઉછાળા સાથે રા. ૪૯૦-૫૧૦નો ભાવ આવી જવાની ગણતરી છે અને તેથી શોર્ટટર્મ માટે થોડાક શેરો લઈને મૂકી દેજો.

આઇટીસીમાં હોટલ બિઝનેસના ડિમર્જર પછી શેરના ભાવમાં થોડોક ઘટાડો જોવાયો અને તેથી આ ઘટાડા માટે કેટલાક એનાલિસ્ટોએ કારણ પણ રજૂ કરી દીધું કે ડિમર્જર બજારને પસંદ નથી પડ્યું પરંતુ આઈટીસીમાં ગયા અઠવાડિયા દરમ્યાન જે ઘટાડો જોવાયો તે એક નોર્મલ કરેકશન છે અને શેર હજી પણ મજબૂત અપટ્રેન્ડમાં આગળ વધી રહ્યો છે.

આગામી દિવસોમાં રૂા. ૧૫૫૧ વાળા **યુનાઇટેડ બ્રુવરી**ના શેરમાં ધીમો સુધારો જોવાવાની સંભાવના મજબૂત છે અને તેથી તે શેર ઉપર ફોક્સ રાખી

અને તેવી જ રીતે રૂા. ૧૩૮૨ વાળા **રેડિકો ખેતાન**ના શેરમાં પણ આગામી દિવસોમાં ખૂબ જ સુંદર ઉછાળાની ગણતરી છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

સુલા વિનચાર્ડના આઈપીઓ વખતે તેમાં રોકાશ કરવાનું દર્શાવેલું અને તે પછી સુલા વિનયાર્ડ અત્યારે રૂા. ૪૮૦ ઉપર આવી ગયો છે અને આગામી દિવસોમાં આ શેરમાં સુંદર ઉછાળા સાથે રૂા. ૪૯૫-૫૦૫નો ભાવ જોવા મળવાની સંભાવના છે અને તેથી આ શેર લોંગટર્મ માટે પણ જાળવી

અદાણી વિલ્મરનો શેર રા. ૪૦૭ ઉપર છે અને હજી પણ આ શેર નબળાઈ અને કરેકશનના તબક્કામાંથી ક્યારે બહાર આવશે તે સ્પષ્ટ નથી થયું. વધારે નીચા ભાવે મળી શકે તેમ લાગે છે.

સામે પક્ષે પતંજલિ દ્વારા બે આઈપીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પતંજલિનો શેર રૂા. ૧૩૧૭ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં આ શેર ઝડપથી ઉછાળા સાથે રૂા. ૧૩૫૭ અને તે પછી રૂા. ૧૩૭૭ ઉપર પહોંચી જવાની સંભાવના મજબૂત છે અને તે રીતે થોડાક શેરો લઈને મૂકી શકાય.

મેન્ટેનફાર્મા દ્વારા બે મુખ્ય બિઝનેસ ધરાવાય છે. એક તરફ કોન્ડોમનો એફએમસીજી પ્રકારનો બિઝનેસ છે જ્યારે બીજી તરફ આ કંપની ફાર્મા બિઝનેસ ધરાવે છે. આઈપીઓ પછી આ શેર મજબૂત સુધારા સાથે રૂા. ૨૦૦૦ની નજીક પહોંચીને અત્યારે રૂા. ૧૮૫૧ ઉપર આવ્યો છે. શેર મેજર અપટ્રેન્ડમાં છે અને તેને કારણે આ શેરમાં હજી રોકાણ થોડા દિવસો જાળવી રાખજો અને તેમાં વધારે સુંદર ઉછાળાની જગ્યા દેખાય

शहतर ?

ડ્રાઈવર, રસોયા, नोક्२ शोधवा हवे ખૂબ જ સરળ staffavailable.com

ના એક્દમ અલગ प्रहारना अने देशमां એકમાત્ર આવી સવલત ઓફર કરતાં પ્લેટફોર્મ ઉપ૨ તમારી જરૂરિયાત મૂકી દો

तद्दन ङ्री

staffavailable.com

આઈપીઓ લાવવાની તત્પરતા હોય. તેમ છતાં છેલ્લા થોડા દિવસોથી ભરશામાં ઓવર સબક્રિપ્શનનું પ્રમાશ ઘટતું જાય છે.

પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

એફએમસીજી કંપનીઓના અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે તે અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં ચોક્કસપણે સારા છે અને મોટા ભાગની કંપનીઓમાં વેચાણો વધ્યા છે અને નફાશક્તિમાં પણ સુધારો છે અને તેની સીધી અસર અત્યારે એફએમસીજી શેરોના ભાવ ઉપર શરૂ થઈ ગઈ છે. તેમ છતાં એફએમસીજી ઇન્ડેક્ષના લગભગ ૫૦ ટકા શેરો ફરી એક વખત કરેકશનમાં ખૂંપી જાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે અને આ પાસું થોડુંક નકારાત્મક કહી શકાય.

હિન્દુસ્તાન યુનિલિવરનો શેર અત્યાર સુધી મેજર અપટ્રેન્ડમાં હતો પરંતુ ગયા અઠવાડિયાથી આ શેર ફરી એક વખત કરેકશનમાં દાખલ થઈ ગયો છે. જૂનના પ્રથમ અઠવાડિયે આ શેરે રૂા. ૨૭૭૦નું ટોપ બતાવ્યું હતું અને અત્યારે ઘટીને રૂા. ૨૫૭૦ ઉપર આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં હજી આ શેર વધારે ઘટાડા સાથે ર્રા. ૨૫૫૫ અને તે પછી રૂા. ૨૫૩૮ આસપાસ આવી જાય તો નવાઈ નહિ

તેવું જ કરેકશન અત્યારે દ્વારાનિયાના શેરમાં પણ શરૂ થઈ ગયું પરિણામો એકંદરે સંતોષકારક આવ્યા પછી હવે આ શેર ખૂબ જ ઓવર વેલ્યૂ થઈ ગયો હોવાથી તેમાં હવે પ્રોફિટ બુકિંગ ચાલે છે. અત્યારે ર્રા. ૪૮૭૩ ઉપર આવેલા આ શેરમાં હવે આવતા થોડા દિવસોમાં રૂા. ૪૮૫૨ અને તે પછીના ઘટાડે રૂા. ૪૬૩૨નો ભાવ જોવા મળી જાય તે સંભાવના

આવો જ ઘટાડો **નેસ્લે**ના શેરમાં પણ શરૂ થઈ ગયો છે. નેસ્લેમાં પણ પરિણામો સંતોષકારક આવ્યા પરંતુ તે પછી શેર અત્યારે રૂા. ૨૨૩૨૫ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં રા. ૨૧૯૬૭ અને તે પછીના ઘટાડે ર્રા. ૨૧૬૦૦ સુધી ભાવ ઉતરી જવાની ગણતરી છે અને તે પછી પણ કરેકશન ચાલુ રહે તો આ શેર એક તબક્કે રૂા. ૨૦૮૦૦નો ભાવ પણ બતાવી દેશે.

શોર્ટટર્મ ખેલાડીઓ ગોદરેજ ક્રુઝ્યુમરમાં પણ અત્યારે મંદીમાં આવી ગયા છે. આ શેરમાં પણ નફાશક્તિની સરખામણીમાં ભાવ અતિશય મોંઘા પીઈરેશિયો ઉપર પહોંચી ગયો હોવાથી તેમાં રૂા. ૧૧૦૦ના લેવલથી ઘટાડો શરૂ થયો છે. અત્યારે ૧૦૩૦ ઉપર આવ્યો છે એન આવતા થોડા દિવસોમાં ભાવ વધારે ઘટીને રૂા. ૧૦૨૧ અને તે પછી રૂા.૧૦૧૦ સુધી ઉતરી જવાની ગણતરી છે. એક તબક્કે રૂા. ૯૯૦નો ભાવ પણ આ શેરમાં શક્ય છે.

આવું જ કરેકશન અત્યારે રૂા. ૮૫૦ વાળા **તાતા કન્ઝ્યુમર**ના શેરમાં પણ શરૂ થઈ ગયું છે. ભાવિ ભલે સુંદર હોય પરંતુ નફામાં મોટો ઉછાળો ન હોવાને કારણે થોડુંક પ્રોફિટ બિ્કિંગ શરૂ થઈ ગયું છે. રૂા. ૮૫૦વાળો આ શેર આગામી દિવસોમાં ધીમા ઘટાડા સાથે રૂા. ૮૩૮ અને તે પછી રૂા. ૮૨૬ સુધી ઉતરી જવાની ગણતરી છે અને તેથી જો તમે લાંબાગાળાના ઇન્વેસ્ટર હો તો તાતા કન્ઝ્યુમરના આ ઘટાડાના તબક્કામાં થોડુંક રોકાણ કરી દેજો.

સામે પક્ષે રૂા. ૨૦૦૨ ઉપર આવી ગયેલો **કોલગેટ** અતિશય મોંઘા વેલ્યુએશન ઉપર પહોંચી ગયો છે અને તેથી તે શેરમાં પ્રોફિટ બુકિંગ કરી દેવાય. જયારે રૂા. ૯૯૭વાળા ચુનાઇટેડ સ્પીરીટના શેરમાં મજબૂત અપટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને આવતા થોડા દિવસો દરમ્યાન આ શેર વધારે ઝડપથી વધીને રૂા.૧૦૧૦ અને તે પછી રૂા. ૧૦૨૬ ઉપર પહોંચી જવાની સંભાવના મજબૂત છે.



બિકાજીના શેરમાં પણ છેલ્લા થોડા દિવસોમાં તોતીંગ ઉછાળો જોવાયો. મે આખરમાં આ શેર રૂા. ૩૭૦ આસપાસ ચાલતો હતો અને અત્યારે વધીને રૂા. ૪૭૨ ઉપર આવી ગયો છે. આમ બે મહિનામાં જ આ શેરે રૂા. ૧૦૦નો ઉછાળો બતાવ્યો છે અને હજી પણ આ શેરમાં આગામી દિવસોમાં સુંદર ઉછાળા સાથે રૂા. ૫૦૦ સુધી ભાવ પહોંચી જવાની સંભાવના છે.

સોફ્ટ ડ્રિંગ્સના માર્કેટમાં મજબૂત

સ્થાન ધરાવતી **વરૂણ બેવરેઝીસ**નો શેર એક તબક્કે રૂા. ૮૫૦ થયા પછી રૂા. ૮૦૦ ઉપર આવ્યો છે અને આ ઘટાડા માટે વહેલો શરૂ થઈ ગયેલો વરસાદ મુખ્ય કારણ છે. આ વર્ષે સૌ પ્રથમ વાવાઝોડું આવ્યું અને તે પછી નોર્મલ ટાઇમ ટેબલ કરતા વરસાદ થોડોક વહેલો આવી ગયો અને તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ઠંડાપીણા, એરકન્ડીશનરો તેમજ વોટરકુલરના વેચાણોને અસર પડી છે અને તમામ શેરોમાં અત્યારે ઘટાડાનો ટ્રેન્ડ છે. વરૂણ બેવરેઝીસમાં પણ આ જ કારણસર નાના કરેકશન પછી ફરી એક વખત ભાવ ઝડપથી રૂા. ૮૫૦નું લેવલ કૂદાવી દેશે તેમ દેખાય છે.

બેક્ટર કુડનો શેર રૂા. ૮૭૬ ઉપર છે અને આ શેરમાં પણ હજી લાંબા ઉછાળાની જગ્યા દેખાય છે. ધીમા સુધારા સાથે આ શેરમાં લગભગ ૧૦થી ૧૨ અઠવાડિયામાં રૂા. ૯૫૬નો ભાવ જોવા મળી જવાની સંભાવના મજબૂત છે અને તે રીતે થોડાક શેરો લઈને મૂકી

હેરીટેજ કુડનો શેર અત્યારે રૂા. ૨૭૩ ઉપર આવી ગયો છે. મે આખરમાં આ શેર રૂા. ૧૬૦ ઉપર હતો અને તે રીતે આ શેરે છેલ્લા એક જ મહિનામાં રૂા. ૧૦૦નો ઉછાળો બતાવ્યો છે અને આગામી દિવસોમાં આ શેરમાં રૂા. ૨૭૮-૨૮૪ સુધી ભાવ જવાની સંભાવના છે અને તેથી રોકાશ હોય તો જાળવી રાખજો.

પરાગમિલ્ક કુડનો શેર રૂા. ૧૫૩ ઉપર છે અને આ શેરમાં પણ નાનું કરેકશન જોવાયા પછી વધારે તીવ્ર ઉછાળો જોવા મળવાની સંભાવના છે અને આ વખતના ઉછાળે રૂા.૧૬૦ અને તે પછી ઝડપથી રૂા.૧૮૦ ઉપર ભાવ આવી જાય તો નવાઈ નહિ લાગે.

શોર્ટટર્મ ખેલાડીઓ ગોદરેજ **એગ્રોવેટ**ના શેર અંગે સહેજ પણ બુલીશ નથી રહ્યા. છેલ્લા પાંચ વર્ષથી આ શેરમાં કમાવાશે તેમ બધા જ એનાલિસ્ટો દર્શાવી રહ્યા છે પણ આ શેર પણ બરાબરની જીદ પકડીને બેઠો અને એક નાની રેન્જમાં જ રમ્યા કરે છે. ઉપરમાં રૂા. ૫૨૦ આસપાસ પહોંચે અને તે પછી કરેકશન શરૂ થઈ જાય અને તે પછી નીચામાં રૂા. ૪૨૦ સુધી ઉતરી જાય. આમ આ પ્રકારના રેન્જબાઉન્ડ ટ્રેન્ડનો લાભ લઈને કમાવું હોય તો દેખાતી.

ઉપર છે અને આ શેરમાં પણ આગામી દિવસોમાં ધીરે ધીરે ભાવ વધીને ર્રા. ૮૬૫ ઉપર પહોંચી જવાની ગણતરી છે અને તેથી લગભગ આઠ અઠવાડિયા જાળવવો પડશે તે રીતે આ શેરમાં રોકાણ જાળવી રખાય.

સમાચારો પણ થોડા દિવસો પહેલા ગણતરી છે. એક તબક્કે રૂા. ૪૫૧નો કરેકશનના તબક્કામાં છે અને આગામી લાગે. દિવસોમાં આ શેરમાં નાનો ઘટાડો જોવા મળે તે સંભાવના મજબૂત છે. નીચામાં એક તબક્કે રૂા. ૨૬૨૬ અને તે પછી રૂા. ૨૫૦૦ સુધી ઉતરી જાય તો પણ નવાઈ નહિ લાગે.

પડ્યું છે. કેટા પેટર્નનો શેર એક તબક્કે રૂા. ૨૨૫૦ સુધી પહોંચી ગયો હતો અને અત્યારે ઘટીને ર્રા. ૧૯૮૨ ઉપર લાંબી તેજીની જગ્યા દેખાય છે અને તેથી એન્ટ્રી લઈ લેશો તે સલાહભરેલ છે.

પારસ ડિફેન્સ અત્યારે રૂા. દદ૭ ઉપર છે અને આ શેર પણ છેલ્લા રૂા. ૩૬૮નો ભાવ જોવા મળી જાય બે અઠવાડિયાથી કોન્સોલિડેશનનો ટ્રેન્ડ તેવી ગણતરી છે. બતાવે છે. પારસ ડિફ્રેન્સમાં હજી થોડા રાખજો.

અત્યારે રૂા. ૩૮૫૨ ઉપર છે. અને આ શેરમાં આવતા થોડા દિવસો હજી કોન્સોલિડેશનનો ટ્રેન્ડ જોવાયા પછી એક ૧૩૬૪ ઉપર છે અને તેમાં પણ છેલ્લા નવી તેજીની સંભાવના દેખાય છે અને એક અઠવાડિયાથી નાનું કરેકશન શરૂ ઉછાળામાં રૂા. ૩૯૧૯નો ભાવ જોવા થયું છે અને તેમાં ભાવ ઘટીને એક મળી જવાની ગણતરી છે.

કોચીન શિપચાર્ડ અત્યારે રૂા. નવાઈ નહિ લાગે. ૬૭૦ ઉપર છે અને આ શેરમાં પણ મેજર ટ્રેન્ડ અપટ્રેન્ડ દર્શાવે છે. અને તેમાં પણ અત્યારે રોકાણ જાળવી

મઝગાંવ ડોકના શેરમાં અત્યારે રૂા. ૧૯૦૨નો ભાવ છે અને આ શેર પણ આગામી દિવસોમાં ઝડપી ઉછાળા સાથે રૂા. ૨૦૦૦નું લેવલ કૂદાવી દેશે અને તે પછી રૂા. ૨૧૦૦ તરફ આગળ વધે તેમ દેખાય છે. રૂા. ૨૦૦૦નું બુકિંગ શરૂ કરી દેજો.

હસ્તકની **ભારત ઇલેક્ટ્રોનિક્સ** અત્યારે આવી ગયો છે અને આગામી દિવસોમાં રૂા. ૧૨૭ ઉપર આવ્યો છે અને આ આ શેરમાં હજી સુંદર ઉછાળા સાથે રૂા. શેરમાં હજી મોટા ઉછાળાની જગ્યા ૧૭૭૭ અને તે પછીના ઉછાળે રા. બાકી છે અને તેથી આ શેરમાં રોકાશ ૧૮૦૨નો ભાવ જોવા મળવાની સંભાવના છે. જાળવી રાખજો.

થોડા સમય પહેલા આઈપીઓ લઈને આવેલી **ડીસીએક્સ સિસ્ટમ**માં અત્યારે રૂા. ૨૬૧નો ભાવ ચાલે છે અને આવતા થોડા દિવસોમાં મજબૂત ઉછાળા સાથે રૂા. ૨૯૦-૨૯૮નો ભાવ જોવા મળી જાય તેવી ગણતરી છે. અને છે. અને હજી નવા અઠવાડિયાના તેથી થોડોક વખત હજી રોકાણ જાળવી

મોટા ભાગની કંપનીઓના આંકડા અપેક્ષા કરતા ઘણા જ સુંદર આવ્યા છે. એપ્રિલથી જૂન દરમ્યાન ખાદ્યપદાર્થોનો ભાવ આસમાને હતા પરંતુ વીજળી અને અન્ય ખર્ચામાં થોડોક ઘટાડો થયો છે અને આ પાસું હોવાની સાથે સાથે ટુરિસ્ટ ટ્રાફિક ખૂબ પરિણામો સારા આવ્યા છે.

ઇન્ડિયન હોટલનો શેર અત્યારે રૂા. ૩૮૪ ઉપર છે અને આગામી દિવસોમાં આ શેરમાં નાના કરેકશન પછી રૂા. ૩૯૦ અને તે પછી રૂા. ૪૦૪નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે.

તેવી જ રીતે ઇઆઇએચ **લિમિટેડ**નો શેર અત્યારે રૂા. ૨૧૨ ઉપર ચાલે છે. અને આ શેરમાં પણ મેજર ટ્રેન્ડ પોઝિટિવ છે. આવતા થોડા દિવસોમાં રૂા. ૨૨૬નો ભાવ જોવા મળી જાય તો નવાઈ નહિ લાગે.

લેમન-ટ્રી હોટલ અત્યારે રૂા. ૯૧-૯૨ ઉપર છે અને આ શેરમાં છેલ્લા બે અઠવાડિયાથી પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે. તેમ છતાં આવતા થોડા દિવસોમાં આ શેર એક વખત રૂા. ૧૦૦નું લેવલ કૂદાવી દેશે તે નક્કી છે અને તેથી નાનું કરેકશન પસાર થઈ જાય ત્યાં સુધી રાહ જોશો.

રેસ્ટોરન્ટ અને ફ્રાસ્ટ મુવિંગ કંપનીઓમાં પરિણામો ખૂબ જ સુંદર આવી રહ્યા છે. તેમ છતાં છેલ્લા થોડા દિવસોથી આ શેરોમાં પણ ટુંકી વધઘટનો ટ્રેન્ડ છે.

દેવિયાની ઇન્ટરનેશનલ રૂદ ૧૯૪ ઉપર આવ્યો છે અને થોડા દિવસો

અલગ વાત છે. બાકી આ શેરમાં લાંબું પહેલા જ આ શેરમાં રૂા. ૨૦૭નો ભાવ રિટર્ન છૂટી જવાની કોઈ આશા નથી જોવાયો હતો.

જ્યુબીલન્ટ કુડ રૂા. ૪૭૦ **ડોડલા ડેરી** અત્યારે રૂા. ૭૩૩ ઉપર છે અને આ શેરમાં અત્યારે શોર્ટટર્મ ઘટાડાનો તબક્કો શરૂ થયો છે. ટામેટા અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવ આસમાને હોવાને કારણે આ કંપનીની નફાશક્તિને અસર પડવાની સંભાવના છે અને તે ભયને કારણે ખેલાડીઓ અત્યારથી જ આ શેર વેચી રહ્યા છે. અમદાવાદ ખાતેની **વાડિલાલ** નીચામાં રૂા.૪૬૫ અને તે પછી રૂા. **ઇન્ડસ્ટ્રીઝ**નું ટેઈકઓવર થાય છે તેવા ૪૬૦ સુધી ભાવ ઉતરી જવાની સંભળાતા હતા અને તે પછી શેર ભાવ પણ બતાવી દે તો નવાઈ નહિ

ઓનલાઈન હોટલ બુકિંગનું કામકાજ કરતી **ઇઝ માચ ટ્રીપ**ના બિઝનેસમાં તોતીંગ ઉછાળો આવવા છતાં આ શેર તરફનું આકર્ષણ તદ્દન ખતમ થતું જાય છે. અત્યારે ફક્ત ર્રા. છેલ્લા એક અઠવાડિયાથી ૪૧ ઉપર આવી ગયો છે અને આ ડિફ્રેન્સ શેરોમાં થોડુંક સેન્ટીમેન્ટ નબળું કરેકશન હજી કેટલું લાંબુ ચાલશે તે સ્પષ્ટ નથી થતું અને તેથી તેમાં નવું રોકાણ કરવાની ઉતાવળ ન કરાય.

મહિન્દ્રા હોલિકે રિસોર્ટનો શેર આવ્યો છે તેમ છતાં આ શેરમાં હજી રૂા. ૩૪૫ ઉપર છે. ગયા અઠવાડિયા દરમ્યાન આ શેરમાં રૂા. ૩૬૫નો ભાવ શોર્ટટર્મમાં વેચીને નીચા ભાવે તરત જ જોવાયો હતો અને તે પછી રૂા. ૨૦ ઘટ્યા છે, રોકાશ જાળવી રખાય. આગામી દિવસોમાં ધીમા સધારા સાથે

ઝોમેટો પકડી લેવાનું ગયા દિવસો આ પ્રકારનો ટ્રેન્ડ રહ્યા પછી એક અંકમાં ખાસ દર્શાવેલું અને બે આંકડાના ઝડપી ઉછાળો શરૂ થઈ જાય તેવી આ શેરમાં ભાવ વધીને રૂા. ૮૫ ઉપર ગણતરી છે અને તેથી રોકાણ જાળવી આવી ગયો છે. હજી આ શેરમાં રોકાણ જાળવી ૨ખાય. અને આવતા થોડા **હિન્દુસ્તાન એરોનોટિક્સ** દિવસોમાં રૂા. ૯૧નો ભાવ જોવા મળી જવાની સંભાવના છે.

> **સેફાચર કુડ** અત્યારે રૂા. તબક્કે રૂા. ૧૩૩૧ સુધી ઉતરી જાય તો

કોરોના મહામારી પછી હવે ફ્રુટવેર કંપનીઓના વેચાણો નોર્મલ લેવલે આવ્યા છે. ઓનલાઇન વેચાણો વધવાની સાથે સાથે હવે સ્ટોર ખાતેના વેચાણોમાં પણ સુંદર ઉછાળો શરૂ થઈ ગયો છે અને તે પાછળ આગામી દિવસોમાં ફુટવેર કંપનીઓના આંકડા લેવલ આવ્યા પછી આંશિક પ્રોફિટ સુંદર આવવાની સંભાવના છે. **બાટા**નો શેર મે આખરમાં રૂા. ૧૪૫૦ ઉપર સામે પક્ષે ભારત સરકાર હતો અને અત્યારે રૂા. ૧૭૦૩ ઉપર ગણતરી છે.

કરતી **કેમ્પસ કુટવેર** અત્યારે રૂા. ૨૯૮ ઉપર ચાલે છે. મે મધ્યમાં આ શેરમાં રૂા. ૩૮૦નું ટોપ બન્યું હતું અને તે પછી કરેકશન અને પ્રોફિટ બુકિંગ શરૂ થયા આખર સુધી આ શેરમાં ભાવ ઘટે તેવી સંભાવના છે. નીચામાં રૂા. ૨૮૪થી રૂા. ૨૯૨ની રેન્જમાં ટ્રેન્ડ રિવર્સ થવાની સંભાવના છે અને તેથી તે શેર ઉપર ખાસ ફોકસ રાખવું.

લિબર્ટી કુટવેર અત્યારે રૂા.૨૩૦ ઉપર છે અને તેમાં પણ શોર્ટટર્મ નબળાઈનો તબક્કો છે. આવતા થોડા દિવસોમાં ઘટીને ર્રા. ૨૨૨ સુધી આવી જાય તે સંભાવના મજબૂત છે.

પૂર્વ ભારતના માર્કેટમાં મજબૂત જ ઝડપથી ઊંચકાયો હોવાથી હોટલોના સ્થાન ધરાવતી **રિલેક્સો કૂટવેર** પણ બાટાની જેમ મે મહિનાની શરૂઆતથી સતત વધતો જાય છે. મે મહિનાની શરૂઆતમાં રૂા. ૮૪૦ વાળો શેર અત્યારે રૂા. ૯૫૩ ઉપર આવી ગયો છે અને આ શેરમાં આવતા થોડા દિવસોમાં જ રૂા. ૯૭૪નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.

તારીખઃ૨૮.૭.૨૦૨૩

સ્થળ :અમદાવાદ

રીટેઈલ કંપનીઓના વેચાણો પણ હવે ઝડપથી સુધરી રહ્યા છે. અને મોટા ભાગની રીટેઈલ કંપનીઓમાં તો કોરોના અગાઉનું લેવલ આવતું જાય છે. સાથે સાથે આ કંપનીઓએ ઓનલાઇન હાજરી પણ મજબૂત ઊભી કરી છે. પ્રોત્સાહક પરિણામો છતાં અત્યારે રીટેઈલ શેરોમાં કરેકશનનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને તેનું મુખ્ય કારણ છે કે વેલ્યૂએશન અતિશય મોંઘા હતા. **ડીમાર્ટ**માં રા. ૪૧૫૦નં લેવલ ટચ થયા પછી ભાવ ઘટીને રૂા. ૩૬૯૩ ઉપર આવ્યો છે. અને આગામી દિવસોમાં આ શેરમાં ભાવ વધારે ઘટીને રૂા. ૩૬૨૪ અને તે પછીના ઘટાડે રૂા. ૩૫૫૩ સુધી ઉતરી જાય તે સંભાવના મજબૂત છે.

આદિત્ય બિરલા ફેશનના શેરમાં પણ અત્યારે કરેકશન અને કોન્સોલિડેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અત્યારે રૂા. ૨૧૭ ઉપર છે અને આ શેરમાં હજી થોડા દિવસો કોન્સોલિડેશન અને નબળાઈનો ટ્રેન્ડ જોવા મળે તે સંભાવના મજબૂત છે.

ફુટવેર રીટેઇલિંગના માર્કેટમાં મેટો બ્રાન્ડઝ ખબ જ મોટું નામ થઈ ગયું છે અને પ્રિમિયમ ફ્રુટવેરમાં પણ આ કંપની મજબૂત માર્કેટ હિસ્સો હાંસલ કર્યો છે. રાકેશ ઝૂનઝૂનવાલાએ લિસ્ટિંગ અગાઉના શરૂઆતના તબક્કામાં જ આ શેરમાં રોકાણ કરી નાખ્યું હતું. આઈપીઓ વખતે પણ આ શેરમાં ભારપૂર્વક રોકાણ કરવાની ભલામણ કરાઈ હતી. અત્યારે રૂા. ૧૦૬૮ ઉપર છે અને આગામી દિવસોમાં મજબૂત ઉછાળા સાથે ર્રા. ૧૧૬૮ અને તે પછી રૂા.૧૨૧૨નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.

અરવિંદ ફેશન એન્ડ રીટેઈલ વાસ્તવમાં રીટેઈલ સ્ટોરનું ખૂબ જ વિશાળ નેટવર્ક ધરાવે છે. પરંતુ અમદાવાદ ખાતેની કંપની હોવાને કારણે તેને યોગ્ય વેલ્યૂએશન નથી મળતું. અત્યારે રૂા. ૩૩૪ વાળા આ શેરમાં ટૂંકી વધઘટ ઉપર જ ભાવ પડી રહે અને તમને કમાવાનો ચાન્સ ન મળે તે સંભાવના મજબૂત છે.

વીમાર્ટ અત્યારે રૂા. ૨૨૩૪ ઉપર છે અને આ શેરમાં ટેઈકઓવર થશે તેવી વાતો સતત બજારમાં ચાલે છે. આગામી દિવસોમાં ધીમા અપટ્રેન્ડ સાથે રૂા. ૨૩૨૩નો ભાવ જોવા મળવાની ગણતરી છે. જયારે ઓશિયા હાઇપર **માર્કેટ**નો શેર સ્મોલકેપ શેરોમાં પકડી લેવાનું ભારપૂર્વક દર્શાવેલું. રૂા. ૩૨ ઉપર લેવડાવેલો આ શેર વધીને અત્યારે રૂા. ૩૮-૪૦ની રેન્જમાં આવી ગયો છે અને આગામી દિવસોમાં આ શેરમાં ર્રા. ૪૪-૪૬નો ભાવ જોવા મળી જવાની

ાો ફેશન એટલે કે ગો કલર્સનો ક્વોલિટી ફ્રુટવેરનું ઉત્પાદન શેર અત્યારે રૂા. ૧૧૭૦ ઉપર છે અને આ શેર પણ હવે લાંબી તેજીમાં દાખલ થયો છે. આગામી દિવસોમાં ધીમા સુધારા સાથે રૂા. ૧૨૨૧નું લેવલ ટચ કરી નાખે તેવી ગણતરી છે.

તાતા ગ્રૂપની ટ્રેન્ટ મે મહિનામાં રૂા. ૧૩૦૦ ઉપર હતો અને અત્યારે વધીને રૂા. ૧૭૦૯ ઉપર આવી ગયો છે. અને આ શેરમાં થોડા દિવસો કોન્સોલિડેશનનો ટ્રેન્ડ જોવાયા પછી નવી મજબૂત તેજી સાથે રૂા. ૧૮૦૦ પ્લસનો ભાવ આવી જાય તે સંભાવના ખૂબ મજબૂત છે.

લગ્નો માટેના ડ્રેસના માર્કેટમાં જોરદાર વેચાણો ધરાવતી માન્યવર એટલે કે **વેદાંત ફેશન**નો શેર રૂા. ૧૨૩૫ ઉપર છે અને શોર્ટટર્મમાં આ શેરમાં નાના ઘટાડાની જગ્યા દેખાય છે. તેમ છતાં લગ્નના પોશાકોમાં આ કંપની એક અલગ માર્કેટ લિડરશિપ ધરાવે છે અને તથી તેમાં રોકાણ જાળવી રખાય.

મેડિકલ ફાર્મસી એટલે કે દવાઓનું રીટેલિંગ કામકાજ કરતી મેડપ્લસનો શેર અત્યારે રૂા. ૯૪૦ ઉપર આવી ગયો છે. ભારતમાં દવાઓનું અતિશય વિશાળ માર્કેટ છે

POLYLINK POLYMERS (INDIA) LIMITED CIN No: L17299GJ1993PLC032905

Registered Office: 229-230, Village: Valthera, Taluka - Dholka, Distt. Ahmedabad, Gujarat - 382225 Ph No.: 079-26427800, Fax: 079-26421864

Website:www.polylinkpolymers.com E-mail: polylink@polylinkpolymers.com

નોટિસ

સેબી(લિસ્ટિંગ ઓબ્લિગેશન તથા ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ) રેગ્યુલેશન,૨૦૧૫ ના રેગ્યુલેશન ૨૯ તથા રેગ્યુલેશન ૪૯ અન્વયે નોટિસ પાઠવવામાં આવે છે કે તા. ૦૮મી ઓગસ્ટ ૨૦૨૩,મંગળવારનાં રોજ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ મળશે,જેમાં ૩૦મી જૂન,૨૦૨૩ ના રોજ પૂરા થયેલા કર્વાટરના અન-ઓડિટેડ નાણાંકીય પરિણામો પર વિચારણા થશે તેમજ મંજૂર કરવામાં આવશે અને અન્ય બીઝનેસ આઇટમો.

આ નોટીસ કંપનીની વેબસાઇટ www.polylinkpolymers.com અને સ્ટોક એક્ષચેંજની વેબસાઇટ www.bseindia.com ઉપર પણ જોઇ શકાશે.

> પોલીલીંક પોલીમર્સ(ઇન્ડીયા)લીમીટેડ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના હુકમ થી

સહી/-અંકીત વગેરીયા કંપની સેક્રેટરી

BPEA EQT set to acquire 60% stake

CHANAKYA

India never disappoints: PM Narendra Modi to global chip companies

With senior executives of over 50 leading semiconductor and electronics companies in attendance, Prime Minister Narendra Modi on Friday pitched India as a trusted partner in the global chip supply chain, saying the country never disappoints anyone. India is rolling out the red carpet for the semiconductor industry, the PM said, referring to fast-paced policy reforms in the area. India has a market of scale and is filled with possibilities, he stated. "Whoever moves fast will get the first-mover's advantage," he said.

On the inaugural day of the second edition of the SemiconIndia global summit here, leaders of global majors, such as AMD, Micron Technology, Applied Materials, and Foxconn, committed investments in India's semiconductor ecosystem. While AMD announced an investment of \$400 million (about Rs. 3,300 crore) in India over five years and opening of a 500,000-sqft R&D campus in Bengaluru, which it said is its largest in the world, Micron reaffirmed its commitment to establish the country's first semiconductor plant in Gujarat, creating 5,000 direct jobs and addressing demand from domestic and international markets.

Hon Hai Technology Group, also known as Foxconn, which recently pulled out of the chip-making joint venture with Vedanta, said it intends to apply for incentives under the government's semiconductor production scheme. Vedanta group Chairman Anil Agarwal, on the other hand, said the first phase of its semiconductor project will involve a \$5-billion

In the first quarter of FY24

(April-June), public sector oil

marketing company Indian Oil

Corporation Ltd (IOCL) saw a

remarkable turnaround as its net

profit soared to Rs 13,750 crore,

bouncing back from a loss of

chip in two and a half years. Other investments in India include a four-year \$400-million plan by US chip equipment maker Applied Materials to set up a new engineering centre in Bengaluru.

Speaking at the event, Modi said semiconductor is not just India's need and that the world needs a trusted reliable chip supply chain as the industry recovers from the pandemic and the Russia-Ukraine war. "Who else than the world's largest democracy can become this trusted partner?" he said, stressing that the country has a stable, responsible, and reform-oriented government.

He also underscored the massive talent pool of skilled engineers and designers that India offers to global chip producers. "Earlier, people were questioning our aim to make chips and were asking 'why invest (in India)'. Now, the question has changed to 'why not invest'," said the prime

At the event, Foxconn CEO Young Liu said the ecosystem for semiconductor chips in India is for the "very brave", as he expressed optimism about the sector's future. "I am very optimistic about where we are headed. Taiwan is and will be your most trusted and reliable partner. Let's build this together," he said.

The three-day SemiconIndia event holds significance government-backed India Semiconductor Mission has gained traction in the past few US-based months.

be ready with made-in-India have recently committed to investing in India's emerging semiconductor industry.

> The government in 2022 launched a \$10-billion semiconductor productionlinked incentive (PLI) scheme that offers fiscal support of 50 per cent of project cost for semiconductor fabs across technology nodes. Despite receiving several proposals, the government has struggled to find an applicant meeting its requirement for setting up a semiconductor manufacturing plant. The government revised the PLI scheme last month and re-invited applications from the industry.

> Nonetheless, the leader in memory chips Micron Technology has announced an assembly, testing, marking, and packaging (ATMP) unit in Gujarat's Sanand industrial area. "On behalf of Micron's global team, I am proud to represent a commitment to build a semiconductor assembly and test facility for memory. Our team here in Gujarat will transform DRAM and NAND memory into finished component packages ready to share to end customers here in India, as well as all across the world," said Sanjay Mehrotra, the CEO of Micron Technology.

Ajit Manocha, president and chief executive officer (CEO) of the global industry body, SEMI, said: "Throughout my career, I have been asked whether India is ready to be part of the global semiconductor industry.

Today, I can say the journey has begun. For the first time, geopolitics, domestic policies, and private sector capacity are semiconductor companies aligned in India's favour to Micron Technology, Applied become a player in investment, and the venture will Materials, and Lam Research semiconductor production."

This increase in margins was

averaged a lower \$4.1 per barrel,

a decrease from \$8.2 per barrel

In 2022, disruptions in

the supply of Russian oil

coupled with a decrease in

petroleum product exports

in Q4 FY23.

Fino Payments Bank Q1 net profit soars 85%, gets board approval for SFB

Fino Payments Bank on Friday reported an 85 per cent jump in net profit to Rs 19 crore for the June 2023 quarter on treasury gains.

The Navi Mumbaiheadquartered entity has received the board approval to apply for converting itself into a small finance bank, which will also allow it to undertake lending operations.

For the reporting quarter, its total income grew to Rs 348 crore from Rs 289 crore in the year-ago period, which included a more than doubling of the income on investments at Rs 25 crore.

The second payments bank to start operations reported an operating profit of Rs 23.28 crore from the treasury segment against Rs 13.38 crore in the year-ago

At an entity level, the operating profit margin

widened to 11.6 per cent from 8.2 per cent a year ago, it said.

It had 14.4 lakh registered merchants and 82.9 lakh current and savings accounts as of

The bank, which added 2.5 lakh customers per month in FY23, saw 7.7 lakh bank accounts being opened during the reporting quarter.

"We intend to supplement payments bank business with lending to known customers through enhancement of license," its managing director and chief executive Rishi Gupta said, adding that the opportunity is significant given its network.

Its chief financial officer Ketan Merchant said the SFB will be different from existing players and will derive 75-80 per cent of its revenues from fees in the first few years of

Piramal Enterprises logs consolidated net profit of Rs 509 crore in Q1

Piramal Enterprises has posted consolidated net profit of Rs 509 crore in the quarter ended June 30 (Q1FY24), led by gain of Rs 855 cr on sale of stake in Shriram Finance.

The non-banking finance company had posted a net profit of Rs 8,155 crore in Q1FY23. Its net interest income (NII) declined by 17 per cent year-on-year (YoY) basis to Rs 891 crore in O1FY24 from Rs 1,069 crore in Q1FY23.

Dwelling on NII trend, Jairam Sridharan, managing director, Piramal Capital & Housing Finance said the NII declined due to rise in share of non-earning assets on issuance of Security Receipts

worth Rs 2,004 crore. The interest expenses also went up, Sridharan added.

Firm to buy back shares worth Rs 1,750 crore

Piramal Enterprises will buy back its equity shares valued upto Rs 1,750 crore for effective utilisation of capital and creating long term value for stakeholders.

The board of directors has approved a buyback up to 14 million equity shares (face value of Rs 2 each) at a price of Rs 1,250 per share.

This represents 5.87 per cent of the pre-buyback fully paid-up equity shares.

Coca Cola to be official beverage partner for upcoming ICC World Cup

Beverages major Coca-Cola on Friday said it will be the exclusive non-alcoholic beverage partner of the ICC for the upcoming Cricket World

Coca-Cola and The

Roy Said: "We believe that the ICC Cricket World Cup is the biggest cricket event for the country. Partnership with the ICC provides us with a great opportunity to bring together our customers, consumers,

brands and cricket".



Cricket World Cup, said a joint statement.

"The partnership entails Coca-Cola becoming the exclusive non-alcoholic beverage partner of the ICC," it added.

global reach to connect with fans around the world and inculcate true sportsmanship through a series of online and offline activations.

President, Marketing, Arnab

The beverage major plans brand activations with its portfolio, including fan engagements, social media campaigns and promotions to win tickets to the World Cup alongside

unique on-ground experiences during the ICC Men's Cricket

ICC Chief Commercial present a grand showcase of their emotions".

Last month, the ICC had announced the schedule for the Men's ODI world cup, which is set to commence on October 5 in Ahmedabad, where England and New Zealand will face each in Indira IVF for Rs 6,000 crore We continue to invest in its R&D capabilities and technology, drawing on EQT's in-house expertise within healthcare and digitalisation,"

Market sources revealed that Indira IVF has been valued at over Rs 10,000 crore. BPEA EQT will pick up around 60 per cent stake for about Rs 6,000 crore. Indira IVF declined to

at BPEAEOT.

BPEA EQT is part of EQT, a Swedish global investment firm. BPEA EQT combines the 25 per cent growth. private equity teams from Baring PE Asia (BPEA) and

EQT announced on Friday that BPEA EQT has agreed to acquire a controlling stake in Udaipur-headquartered Indira IVF from TAAssociates and the company's founders —Ajay Murdia, Kshitiz Murdia and Nitiz Murdia, who will retain a

Boston-based Associates owned a 47 per cent stake in Indira IVF. The promoters held 53 per cent.

significant minority stake and

also continue to lead the

Hong Kong-headquartered

investment firm BPEA EQT will acquire a majority stake in

India's largest fertility services

provider Indira IVF for an

comment on the deal size.

EQT Asia.

company.

undisclosed sum.

Ajay Murdia had founded Indira IVF in 1988. Since then, it has scaled from a single clinic to a pan-Indian network of 116 centres across 20 states.

It is the market leader within reproductive assisted technology (ART) services in India and completes about 40,000 IVF cycles annually. It also ranks among the top-five players globally.

To date, Indira IVF has successfully supported over 125,000 couples in their journey towards achieving pregnancy.

"Fertility services and reproductive health are fastgrowing opportunities in India and Indira IVF is a pioneer in this space. We see strong potential in further expanding Indira IVF's presence across India and entering adjacent the Centre is trying to regulate announced public offers, if

said Ashish Agrawal, partner

Kshitiz Murdia, CEO of Indira IVF, said the partnership with BPEA EOT is the beginning of a new phase.

Indira IVF chain of fertility clinics now enjoys a 16-17 per cent share of the IVF market in India. Indira IVF is eyeing a 20-

It posted a turnover of Rs 1,205 crore for FY23, with an earnings before interest, taxes, depreciation, and amortisation (Ebitda) margin of 30-35 per

Each IVF cycle costs around Rs. 1.7-2 lakh, and another Rs. 1-1.5 lakh is needed during the nine-month pregnancy.

India is one of the fastestgrowing markets globally for ART services and is significantly under penetrated compared to more developed markets.

Infertility rates in India are estimated to be around 15 per

They are expected to rise, driven by lifestyle changes, such as poor diet, high stress levels, and pollution.

Today, India completes around 300,000 IVF cycles annually, and over the next decade, the number is expected to grow at a compound annual growth rate (CAGR) of 15 per

This trend is supported by rising awareness about infertility treatments, declining fertility rates, and increasing marriage age.

The growing market for fertility clinics in the country is likely to witness some consolidation. This comes as and/or signed investments and this fast-growing sector, which applicable.

is becoming the 'new diabetes'

ART and surrogacy laws have been introduced to regulate the practices in India by registering the clinics performing such treatments. It is also to stop the commercialisation of donors and surrogates in India.

According to the law, these clinics need to adhere to certain requirements for being recognised as legal entities.

M&A activities are set to increase, feel industry, and more partnerships between organised players and momand-pop shops are in store.

From 2018 till date, the sector has already seen investments of \$318 million from leading PEs and VCs, shows data from Venture Intelligence.

The organised sector, which now has a 17-18 per cent share of the Rs. 6,000-7,000-crore market, is growing faster at 15-20 per cent. The overall industry - which comprises singledoctor clinics, unorganised players apart from organised chains — is growing at 12-15 per cent.

Jimmy Mahtani, partner and co-head of BPEA EQT India, said, "This investment aligns with EQT's commitment to investing in companies that address critical societal needs and have the potential to impact people's lives for the better."

BPEA EQT was advised by JSA (legal), Lincoln International, Price Waterhouse & Co LLP (transaction and tax, operational DD), Deloitte (financial and tax DD, structuring, ESG), and Awelin (digital). The selling shareholders were advised by Goldman Sachs and JP Morgan.

With this transaction, BPEA Private Equity Fund VIII is expected to be 35-40 per cent invested. This includes closed

Tesla executives hold market entry talks with India investment agency

Two senior Tesla executives discussed the company's plans to enter India with officials from the country's investment promotion arm in New Delhi, two people with

direct knowledge of the matter said, the latest in series of high level talks.

The U.S carmaker expressed interest building a factory in India that would produce a low-cost electric

vehicle (EV) priced at \$24,000, around 25% cheaper than Tesla's current entry model, for both the Indian market and

The U.S.-based executives - senior public policy and business development executive Rohan Patel, and a vice president for supply chain, Roshan Thomas - are currently in New Delhi and met officials from the Invest India agency, the two sources said, declining to be identified as the discussions were private.

Invest India CEO Nivruti Rai, a former Intel executive, held talks with the Tesla executives during a meeting on Thursday, they added.

not immediately respond to land allotment for a factory. requests for comment.

Most Tesla meetings with Indian officials have been kept under wraps. Reuters reported

this week that Tesla

representatives will also meet

commerce minister Piyush

Date: 28.07.2023

Place: Ahmedabad

Many Indian states are keen to woo Tesla to set up its plant

> in their region, but the carmaker is currently focussed on discussing its


proposal with

federal overnment in New Delhi, said one of the sources.

T h e discussions represent a

sharp reversal company after efforts last year to reduce import taxes on EVs shipped to India were

Goyal, with discussions scuppered by calls from expected to centre on setting government officials to commit up an EV supply chain and to making cars locally.



Taluka - Dholka, Distt. Ahmedabad, Gujarat 382225 CIN: L17299GJ1993PLC032905 E-MAIL: polylink@polylinkpolymers.com PH: 079-26427800 Fax: 079-26421864

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 49 of SEBI (Listing obligation and Disclosure Requirements) Regulations, 2015, Notice is nereby given that a Meeting of the Board of Directors of the Company is Scheduled to be held on Tuesday, 08th August, 2023 Inter alia to consider and take on record the Un-audited Financial Results for the Quarter ended 30th June 2023 and other Business

The Said Notice may also be accessed on the Company's Website at www.polylinkpolymers.com and on the Stock Exchange Website at <u>www.bseindia.com</u>.

> For Polylink Polymers (India) Limited Ankit Vageriya **Company Secretary**

from Rs 6,948 crore in Q1 FY23.

In contrast, the quarter under review saw a 2.6 per cent foreseen even amidst relatively increase in revenue from other business activities to Rs 7,840 lower Gross Refining Margins (GRM) - the revenue refiners crore, up from Rs 7,636 crore accrue from transforming each during the same quarter of the barrel of crude oil into refined previous year. fuel products. The benchmark Singapore GRM, in Q1 FY24,

Indian Oil Q1 net profit soars to

Rs 13,750 cr as marketing margins improve

Rs 1,992.5 crore in the corresponding period last year. Oil marketing companies (OMCs), having faced

Sequentially, the net profit significant losses in the first exhibited a 36 per cent increase from Rs 10,058 crore recorded in Q4 FY23. The significant rise in sequential profit is largely attributed to improved auto-fuel marketing margins and diminished crude costs.

In spite of this, the company's revenue from operations dwindled by 12 per cent to Rs 2.21 trillion when compared to Q4 FY23, constituting a 2.36 per cent quarter-on-quarter (QoQ) downturn.

This drop in revenue is primarily attributed to lower earnings across all major sectors. Specifically, the revenue from petroleum products dipped 13 per cent to Rs 2.1 trillion in Q1 FY24, down from Rs 2.42 trillion the preceding year.

Likewise, sales from the petrochemicals business experienced a marginal 3 per cent fall, down to Rs 6,728 crore

half of FY23, have witnessed a steady recovery in their

improved operational results for OMCs due to a substantial rise in the marketing gains of blended margins, which climbed to Rs 8-9 per litre of fuel sold in Q1 FY24, up from Rs 3

marketing margins over the last four months. Analysts had projected

Nevertheless, as Moscow increased supplies to the international market in late 2022 to fund its ongoing conflict in Ukraine, GRMs experienced a swift downturn. Despite this, Indian OMCs have continued to secure oil from Russia at a





Coca-Cola will use its

Coca-Cola India Vice

World Cup 2023. Officer Anurag Dahiya said: "We are excited about our partnership with Coca-Cola, which promises to deliver a refreshing cricketing experience set to captivate audiences and

Tesla and Invest India did